

The Power of Distribution

### FINANCIAL SERVICES LIMITED

MFSL/SEC/EQ/2019/08

January 31, 2019

To,

The Manager,

**BSE Limited** 

Phiroze Jeejeebhoy Towers

**Dalal Street** 

Mumbai - 400001

To,

General Manager

National Stock Exchange of India Limited

**Exchange Plaza** 

Plot No. C/1, G Block

Bandra-Kurla Complex

Bandra (East)

Mumbai - 400051

Trading Symbol: MASFIN

Scrip Code: 540749

Dear Sir, .

Sub: Newspaper Advertisement of unaudited financial result for the quarter and nine months ended on 31st December, 2018.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the company has given Newspaper Advertisement in One (1) English - FREE PRESS GUJARAT and One (1) Regional Language Newspaper - Gujarati - LOKMITRA for unaudited standalone and consolidated Financial result for the quarter and nine months ended on 31st December, 2018.

Kindly take the same on your record.

Thanking you, Yours faithfully,

FOR, MAS FINANCIAL SERVICES LIMITED

RIDDHI BHAYANI

(COMPANY SECRETARY)

**MEMBERSHIP NO.: A41206** 

Encl. As above



## VS હોસ્પિટલની કાર્યક્ષમતા વધારવા ૨૩૧ કરોડના બજેટની જોગવાઇ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. સંચાલિત વી.એસ. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે મુકેલાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના રૃ. ૧૭૨.૭૦ કરોડના ડાફ્ટ બજેટમાં સત્તાધારી પક્ષે રૃ. ૫૮.૬૬ કરોડનો મોટો વધારો કરીને રૂ. ૨૩૧.૩૬ કરોડના બજેટને મંજુરી આપી છે.

૧૧૫૫ પથારીની ૫૦૦ પથારી થઈ છે, ત્યારે પથારી ઘટવા છતાં બજેટ દોઢ ગણું વધ્યું છે તે અંગે પ્રશ્ન પુછાતો થયો છે. જો કે સૌથી મોટો ખર્ચ એસ્ટાબ્લીશમેન્ટ પાછળ રૂ. ૧૫૭.૪૯ કરોડનો થવાનો છે.

આ અંગે વિગતો આપતા મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં પગાર ભથ્થાં ઉપરાંત મેડિકલ અને જનરલ સ્ટોર્સનો ખર્ચ ર. ૧૧.૨૯ કરોડ, મેડિસીન, સર્જીકલ સાધનો . દવા વગેરે પાછળનો ખર્ચ ૨. ૨૬.૦૧ કરોડ, સિકયોરીટી અને સફાઇ પાછળ ૮.૪૫ કરોડ ખર્ચ થનાર કરોડના વધારામાં ૮ કરોડ તો છે. જયારે આ બજેટને પહોંચી વળવા સિકયુરિટી માટે ફળવાયા છે. તે બાબત મ્યુનિ. ૨૨૪.૦૮ કરોડની ગ્રાન્ટ આશ્ચર્યજનક છે. આપશે. વિવિધ ચાર્જીસમાંથી ૫.૨૭ ૨.૦૦ કરોડની પ્રાપ્ત થશે.



પીએસીએસ, અન્ય મેડિકલ સાધનો માટે પ કરોડ ફાળવાયા છે. મકાનોની અને રેકર્ડના ડિઝીટલાઇઝેશનની વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. પ૮

હિસાબ મ્યુનિ.ના ચીફ ઓડિટર પાસે નથી. જ્યારે મેડિકલ સાધનોમાં ડિઝીટલ ઓડિટ કરવાના બદલે ખાનગી એ ક્સ-રે મશીન, ઇકો મશીન, ઓડિટર પાસે કેમ ઓડિટ કરાવાય છે, કમિશનરે દબાણ કર્યું ત્યારે ઉલ્લેખ નથી.

તેવો સવાલ ઉઠાવ્યો હતો.

પાંચ લાખની કિંમતના ૧૬૨ કિંમતી ઇંજેકસનો ગુમ થયા છે. તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વી.એસ. જનરલ વોર્ડમાં ડિસેમ્બરમાં ૫૦૦ હોસ્પિટલમાં છેલ્લા સાત-આઠ વર્ષમાં પથારીનો નિર્ણય લેવાયો હતો તો ત્રણ-ત્રણ રસીદકાંડ સર્જાયા, પછી સુપ્રિન્ટેન્ડન્ટે ૧૧૫૫નું બજેટ જ્યારે ટ્રસ્ટી મંડળના સભ્યોએ દર ગોટાળો વગેરેમાંથી એક પણ સત્તાવાળાઓ પાસે નથી. આ મુદ્દે કરોડ મળશે અને સરકારી ગ્રાન્ટ વખતની જેમ વી.એસ. હોસ્પિટલનો પ્રકરણમાં ગંભીરતાથી પગલાં લેવાયા વિવાદ શરૂ થયો છે. 'પ્રાયોગિક'

એફઆઇઆર થઇ હતી અન એ પણ એટલી ઢીલી પોચી હતી કે હજુ સુધી એક પણ કડક પગલું લેવાયું નથી. વહિવટમાં મોટા પ્રમાણમાં પોલંપોલ ચાલે છે. પીએફ માટે થયેલી ૮ કરોડની પેનલ્ટી કયાંથી ભરાઇ તે બાબત પણ સ્પષ્ટ નથી.

પથારીની સંખ્યા અંગે વારંવાર જવાબો બદલાયા

વી.એસ. હોસ્પિટલમાં ૧૧૫૫ પથારીની સંખ્યા હતી તે ઘટાડીને હવે ૫૦૦ની પ્રાયોગીક ધોરણે કરવામાં આવી છે. અગાઉ સુપ્રિન્ટેન્ડન્ટે જે ડાફ્ટ બજેટ મુકયું તે ૧૧૫૫ પથારીનું છે. હતું, આજે જે પાસ થયું તે ૫૦૦ પથારીનું છે તેમ મેયરે જણાવ્યું હતું. આ બાબત વિરોધાભાસી છે. વચ્ચે એક જવાબ એવો આવ્યો કે પથારીની સંખ્યાની બાબત હાલ કોર્ટમાં હોવાથી તે અંગે કશં કહી શકાય નહીં. મ્યનિ. ઇંજેકશન ગૂમ થવા, પી.એફ.નો કેમ મુકયું ? તેનો જવાબ ધોરણે શબ્દ પણ પાછળથી ઉમેરાયો રસીદકાંડ અંગે તે સમયના છે. બોર્ડમાં નિર્ણય લેવાયો તેમાં તેનો

આથી સરજીત સિંહે તાત્કાલિક એમટી વિભાગમાં જાણ કરી હતી. વિભાગના અન્ય કર્મચારીઓએ જયારે બહાર આવીને તપાસ કરી તો ત્યાં રહેલા અન્ય વાહનોના ડીઝલની ટાંકની ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા. ત્યાર બાદ વધુ તપાસ કરતાં એક ગાડીમાં નુકસાન જોવા મળ્યું હતું. થોડે દુર તપાસ કરતા એક ગાડી જેમાં સાઈડ લાઈટ તૂટેલી હતી અને તે ગાડીના ટાયરના નિશાન પણ જોવા મળ્યા હતા.પોલીસ ટાયરના નીશાન સાથે ચાલીને આગળ પહોંચી તો ત્યાં એક કાર પાર્ક કરી હતી, જેની સાઈડ લાઈટ અને મેઈન લાઈટ તટેલી હતી. પોલીસે તપાસ કરતાં આ કાર પોલીસ હેડક્વાર્ટરમાં જ રહેતા એક પોલીસકર્મીના પુત્ર દર્પણસિંહ રાઠોડની અને બીજી કાર અન્ય એક પોલીસ કર્મીના પુત્ર સિદ્ધરાજસિંહ સોલંકીની

બોલો ! પોલીસના હેડક્વાર્ટરમાં

પોલીસના જ વાહન સલામત

નથી, તો પ્રજાનું શું?

કાયદો-વ્યવસ્થા કાબમાં હોવાની

ગુલબાંગો પોકારતી હોય, પરંત ખુદ તેના

હેડક્વાર્ટરમાં જ જ્યાં તેના ખુદના વાહનો

સલામત નથી, ત્યારે શહેરની પ્રજાની

સલામતી કેટલી હશે એ ચિંતા ઉપજાવે

છે. મંગળવારે માધવપુરા પોલીસે

અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા

પોલીસ હોડક્વાર્ટરમાં પોલીસના જ

વાહનોમાંતી ચોરી કરતા બે

પોલીસપુત્રોની ધપકડ કરી છે. બંને

આરોપી પોલીસપુત્રોએ ૪-૫

ગાડીઓમાંથી ૩૫૦ લીટરથી વધુ

ડીઝલની ચોરી કરી હોવાની કબુલાત કરી

તરીકે ફરજ બજાવતા સરજીતસિંહ

મંગળવારે તેમની નોકરી પર ચડયા હતા.

એ સમયે તેઓ જયારે પોતાની ગાડીમાં

બેઠા ત્યારે જોયું કે તેમની ગાડીની

ડીઝલની ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. આથી,

તેમને ડીઝલ ચોરીની શંકા ગઈ હતી.

તેમણે નીચે ઉતરીને જોયં તો ગાડીમાં

ડીઝલ ઓછું હતું.

પોલીસના એમટી સેક્શનમાં ડ્રાઈવર

અમદાવાદઃ શહેરની પોલીસ ભલે

પોલીસે હાલ તો શંકાના આધારે આ બંને પોલીસપુત્રોની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના પુત્રો જ જયારે ગેરકાનુની ધંધા કરતા પકડાતા હોય, પોલીસના જ વાહનમાંથી ડીઝલ ચોરી કરતા હોય ત્યારે આ બાબત મોટી ચિંતા ઉપજાવે છે. આથી સરજીત સિંહે તાત્કાલિક એમટી વિભાગમાં જાણ કરી હતી. વિભાગના અન્ય કર્મચારીઓએ જયારે બહાર આવીને તપાસ કરી તો ત્યાં રહેલા અન્ય વાહનોના ડીઝલની ટાંકની ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા.

હોવાનું જાણવા મળ્યું હતું.

### AMARNATH SECURITIES LIMITED

CIN NO. L67120GJ1994PLC023254

Regd. Office: 1/104, Sarthak, Opp. C.T. Centre,B/H. Swastik Cross Road, C.G.Road, Ahmedabad-380009.

Corporate Office: B 207, CITI Point, Nr. Kohinoor Hotel, J B Nagar, Andheri, Mumbai - 59

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2018

Sr.	Particulars	Quarter ended			Nine Months ended		Year ended
No.	Failiculais	31.12.2018	30.09.2018	31.12.2017	31.12.2018	31.12.2017	31.03.2018
INC.		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Revenue from operations	9,95,744	9,99,835	26,88,115	30,37,579	44,98,941	54,35,031
	Other income	3,535			3,535		
	Total revenue	9,99,279	9,99,835	26,88,115	30,41,114	44,98,941	54,35,031
2	Expenses						
	Employee benefits expense	1,51,610	1,29,510	1,50,000	4,47,815	3,55,000	5,17,450
	Depreciation and amortization expense	16,246	16,246	23,949	48,738	71,847	95,796
	Other expenses	1,59,791	2,10,884	1,60,126	5,70,372	3,88,100	7,92,767
	Total expenses	3,27,647	3,56,640	3,34,075	10,66,925	8,14,947	14,06,013
3	Profit/(Loss) from ordinary activities						
	before tax	6,71,632	6,43,195	23,54,041	19,74,189	36,83,994	40,29,018
4	Tax expense:						
	(1) Current tax	1,74,209	1,66,886	5,39,241	5,12,145	9,56,471	11,11,089
	(2) Deferred tax	(1,264)	(1,264)	5,487	(4,434)	(787)	(3,401)
5	Profit/(Loss) from ordinary activities						
	after tax	4,98,687	4,77,573	18,09,313	14,66,478	27,28,310	29,21,330
6	Other Comprehensive Income (OCI)	-	-	-	-	-	-
	Total Other Comprehensive Income (OCI)	-	-	-	-	-	-
	Profit/(Loss) for the Period	4,98,687	4,77,573	18,09,313	14,66,478	27,28,310	29,21,330
	Paid up Equity Share Capital						
	(Face Value of Rs. 10 each)	3,00,02,000	3,00,02,000	3,00,02,000	3,00,02,000	3,00,02,000	3,00,02,000
6	Earning Per Share (EPS) (Not annualised)						
	(1) Basic	0.166	0.159	0.603	0.489	0.909	0.974
	(2) Diluted	0.166	0.159	0.603	0.489	0.909	0.974

1. The above Financial Results which are published in accordance with the regulation 33 of the Securities and Exchange Board Of India (Listing obligations & Disclosure Requirements) Regulations, 2015 have been reviewed and recommended by Audit

Committee and has been approved by the Board of Directors at its Meeting held on Wednesday, 30th January, 2019. The company has adopted Indian Accounting Standard (Ind AS) effective from 1st April' 2017 (Transition date being 1st April' 2016) and accordingly the financial results for the quarter 31st December, 2018 have been prepared in accordance with the

Companies Act' 2013 The company has only one business segment

In compliance with the provisions of RBI Act, company has transferred 20% of the net profit, to the "Statutory Reserve a/c".

Previous quarter figures have been regrouped /reclassified whereever necessary, to make them comparable

recognition and measurement principles laid down in Ind As-34 Interim Financial Reporting prescribed under section 133 of the

Hitesh Ruke Whole-Time Director

(DIN-07752179)

Place: Mumbai Dated: January 30, 2019

#### જાહેર નોટીસ **ICICI** Bank **ICICI Bank Limited**

**રજિસ્ટર્ડ ઓફિસ** : આઈસીઆઈસીઆઈ બેંક ટાવર, ચકલી સર્કલ પાસે, જુના પાદરા રોડ, વડોદરા-૩૯૦૦૦૭, ગુજરાત. **કોર્પોરેટ ઓફિસ :** આઈસીઆઈસીઆઈ બેંક ટાવર્સ, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્ષ, બાંદ્રા (ઈ), મુંબઈ ૪૦૦ ૦૫૧. **બ્રાન્ચ** : આઈસીઆઈસીઆઈ બેંક લી., ઓફીસ નં. ૨૦૧- બી-૨જો માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી૩, વાઇફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, થાશે, મહારાષ્ટ્ર - ૪૦૦૬૦૪.

નીચે જણાવેલ કરજદારો કે જે બાકી નીકળતી મૂળ રકમ અને વ્યાજ કે જે લોન તરીકે તેમણે સલામત દેવાદાર તરીકે લીધી છે તેઓને ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. આ લોન લીધેલી હતી ને હવે લોન નોન પર્ફોર્મીંગ એસેટ (એનપીએ)ના વર્ગમાં લઈ જવામા આવે છે. સિક્યુરાઇઝેશન રિકસ્ટ્રક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ ઇનફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ તેમના મુજબ તેમના જર્ણાયેલા સરનામા ઉપર નોટીસ આપવામાં હતી. તે નોટીસ બજાવ્યા વગર પરત આવી છે અને તે હવે અહી જાહેર નોટીસ દ્વારા માહિતગાર કરવામાં આવે છે.

ક્રમ નં.		જામીનમાં મુકેલ મિલ્કત/અમલમાં આવનારી મિલ્કતનું સરનામું	નોટીસ આપ્યાની તારીખ/ નોટીસની તારીખે બાકી રકમ	એનપીએ તારીખ
٩.	પ્રેક્ષા સિલ્ક કોર્પોરેશન/શ્રી જય ચોરડીયા (પાર્ટનર)/શ્રીમતી હેમલતા ચોરડીયા (જામીનદાર)- ૧૩૮૫૦૫૦૦૧૫૪૭- ૧) બ્લોક નં.૧૬૩,શ્રી કુબેરજી એમ્પાયર, અપર ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નં યુજી ૧૦૩, સરોલી, સુરત- ૩૯૫૦૧૦ ૨) પ્લોટ નં. ૧૮-૧૯, ફ્લેટ નં. ૩૦૪, હેપ્પી હોમ એ, દાગીના નગર, મેધી ની ખામની, ઉધના, સુરત- ૩૯૪૨૧૦ ૩) ૨૦૮, ધીરજ પાર્ક અપાર્ટમેન્ટ, દેસાઈ ફિલયા, ઉધના, સુરત- ૩૯૪૨૧૦	ડી- ૭૦૭, શ્યામ રચના, વીઆઈપી પ્લાઝા પાછળ, વીઆઈપી રોડ, વેસુ, સુરત- ૩૯૫૦૦૭.	૧૦ જાન્યુઆરી, ૨૦૧૯/ રૂા. ૫૮,૦૯,૨૯૮/-	૨૯ સપ્ટેમ્બ૨, ૨૦૧૮
٦.	બજાજ ઇલેક્ટ્રીકલ્સ/અશ્વિનભાઈ જે પટેલ(પ્રોપરાઇટર)શ્રીમતી લાભુબોન પટેલ/શ્રી અશ્વિનભાઈ જે પટેલ- ૦૨૫૭૦૫૦૦૨૭૩૨-૧) ૪૦૨, ચન્દ્રપ્રભુ કોમ્પ્લૈશ, નવદીપ ક્લેટ પાસે,હાઈ-વે,મહેસાણા- ૩૮૪૦૦૨ . ૨) એચ-૧૩૨, સરદાર ધામ જીઆઈડીસી-૨, નાગલપુર-૨૭, તક્ષશીલા સ્કુલ પાસે, મહેસાણા- ૩૨૮૪૦૦૨.	૩જો માળ, શોપ ૪૦૨-૪૦૫ ચન્દ્રપ્રભુ કોમ્પ્લૈક્ષ, નવદીપ ફ્લેટ્સ પાસે, હાઈવે, મહેસાણા-૩૮૪૦૦૨	૧૦ જાન્યુઆરી, ૨૦૧૯/ ફા. ૨૩૨૫૭૭૨/-	૦૧ માર્ચ, ૨૦૧૮

આ નોટીસની વધારાની કાર્યવાહી તરીકે આ પગલુ લેવાયુ છે ઉપરોક્ત કરજદારો અને તેમના જામીનદારો (જેને લાગુ પડતુ હોય તે ) તેમને તાકીદ કરવામાં આવે છે કે આ નોટીસ ૧૩ (૨) હેઠળ પ્રસિદ્ધ થયાનાતારીખ થી ૬૦ દિવસની અંદર બાકી નિકળતા નાણા ભરી જાય અને તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો સિક્યુરાઇઝેશન રિકંસ્ટ્રક્શન ફાઇનાન્સિયલ એસેટ એન્ડ ઇનફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ના ૧૩ (૨)ની જોગવાઈ મુજબ ૬૦ દિવસની મુદ્દત પુરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તારીખ : ૩૧-૦૧-૨૦૧૯ સ્થળ : સુરત

ઓથોરાઈઝડ ઓફિસર આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ

## અમદાવાદમાં પર્યાવરણની જાળવણી માટે મહાનગરપાલિકાએ કર્યા રૂ.૭૦૦૦ કરોડના એમઓયુ

ગાંધીનગરઃ મહાનગરમાં આગામી ૫ વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમ્યાન પર્યાવરણની જાળવણી અને ક્લાઈમેટ ચેંજ મેનેજમેન્ટ માટે રૂ. ૭૦૦૦ કરોડના રોકાણના લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રૂપની ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં એમઓયુ સંપન્ન થયા છે.

આ એમઓયુ અંતર્ગતેં હ્રઝ અમદાવાદ શહેરને ક્લાઈમેટ ચેંજને કારણે થતી આડ અસરો તેમજ પ્રદુષણ ઘટાડવા અંગેની સ્ટ્રેટેજી માટે મહાપાલિકાના નાણાકીય સ્ત્રોતનો સુચારુ ઉપયોગ કરવાની દિશામાં ટેકનીકલ સપોર્ટ આપશે. એટલું જ નહીં ઈ મોબિલિટી

ગ્રીન બિલ્ડિંગ્સ, રિન્યુએબલ એનર્જી, ટાન્સપોર્ટ, વેસ્ટ, વોટર ટીટમેન્ટ તથા ડિઝાઇન અને નાશાકીય સહાય માટે

આ એમઓયુ ને પરિણામે દિશામાં ગતિ મળશે. અમદાવાદ મહાનગર દેશભરમાં



રાજ્યના મુખ્યમંત્રી વિજય અગ્ર સચિવ મુકેશ પુરી, કરવામાં આવી હતી.

ટેક્નિકલ સહાય કરશે. ટેક્નિકલ અને લો ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહાપાલિકાના નાયબ કમિશ્રરો ડેવલમેન્ટ સ્ટ્રેટેજીના અમલમાં મોડેલ અમુલભાઈ, પક્ષના નેતા અમિત અને પી પી પી પી ધોરણે મદદ લેવામાં આવશે. સિટી તરીકે પ્રસ્થાપિત કરવાની શાહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર પ્રતિનિધિઓ ની હાજરીમાં સચિવ એમ કે દાસ, શહેરી વિકાસ એમઓ યુની કાર્યવાહી સંપશ

### સુરતમાં ઉધના પાસે સીટી બસ ચાલકે ૩ને અડફેટે લીધા, ૨ મોત

જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું, જયારે અન્ય બે ને ઇજા પહોંચતા ખસેડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ સીટી બસ પર વિનીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું પથ્થરમારો કરી તોડફ્રોડ કરી હતી. ગંભીર રીતે ઘાયલ દિનેશભાઈનું રોશનીબેન તથા અન્ય દિનેશભાઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત થતાં દરમિયાન મોત થયું હતું.

રોશનીબેન પટેલ તેમની બે વર્ષની બસ પર પથ્થરમારો કરી તેમાં તોડફોડ

પુરપાટ ઝડપે આવેતી સીટી બસના પ્રિતિબેન પોતાની દીકરી વિની તથા ચાલકે ૩ લોકોને અડફેટે લીધા હતા. અન્ય દિનેશ ભાઇ નામના શખ્સ ઝેબ્રા ક્રોસિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પરપાટ ઝડપે આવી રહેલી સીટી બસના ચાલકે આ ત્રણેયને અડફેટે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લેતાં તમામ લોકો ફંગોળાયા હતા.

અકસ્માતમાં બે વર્ષની બાળકી મોત નીપજયું હતું, જયારે માતા ડાઈવર બસ છોડીને ભાગી છુટયો સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતા હતો. અહીં રોષે ભરાયેલા ટોળાએ

## અમેરિકાએ વેનેઝૂએલાની ક્રૂડ કંપની પર પ્રતિબંધ લગાવ્યો

સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણને સ્વીકાર શરૂ થઇ છે. કરવા માટે કહ્યું છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જહોન બોલ્ટને કહ્યું કે, સંપત્તિ લૂટી નહીં શકે. ક્રુડ ઓઇલ સમૃદ્ધ વેનેઝૂએલા હાલ ગંભીર આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. આપી દીધી છે.

વોશિંગ્ટન, વેનેઝૂએલા પોતાના ક્રૂડ બીજી તરફ, જહોન બોલ્ટનના હાથમાં ઓઇલનો મોટો જથ્થો અમેરિકાને જ રહેલી એક નોટમાં ૫.૦૦૦ સૈનિકો નિકાસ કરે છે. અમેરિકાએ વેનેઝૂએલાના કોલંબિયા લખેલું જોવા મળ્યા બાદ સરકારી ઓઇલ કંપની પીડીવીએસએ અમેરિકા ગમે તે ક્ષણે વેનેઝૂએલા પર પર પ્રતિબંધ લગાવતા દેશની સેનાને મિલિટરી હસ્તક્ષેપ કરી શકે છે તેવી ચર્ચા

વિપક્ષી રાજકીય દળોએ પ્રેસિડન્ટ માદ્દરોને પદ પરથી હટાવવાના પ્રયાસો પ્રેસિડન્ટ નિકોલસ માદ્દરો અને તેમના ઝડપી બનાવી દીધા છે. અમેરિકા સહિત સહયોગીઓ હવે વેનેઝૂએલાના લોકોની વિશ્વના ૨૦થી વધુ દેશોએ વિપક્ષના નેતા ખુઆન ગોઇદોને વેનેઝુએલાના વચગાળાના પ્રેસિડન્ટ તરીકે માન્યતા

અમદાવાદ/સુરતઃ સુરતના ઉધના દિકરી વિની સાથે ખરીદી કરવા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં ડ્રાઈવર અને કન્ડક્ટરની મોડી રાત્રે ત્રણ રસ્તા નજીક બીઆરટીએસ નીકળ્યા હતા. ઉધના ત્રણ રસ્તા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે માર્ગમાં ઝેબ્રા ક્રોસિંગ કરતા સમયે નજીકના બીઆરટીએસ માર્ગમાંથી દોડી આવ્યો હતો અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. રીતે બસ હંકારે છે કે તેનો પરાવો એ બાળકીના પરિજનોએ મૃતદેહ લેવાનો છે કે છેલ્લા ચાર દિવસમાં બે અકસ્માત ઈનકાર કરી દીધો છે.

દિનેશભાઇની હાલત અંત્યત નાજુક સ્થળે જ મોત નીપજયું હતું. હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ ગયું છે. આ બનાવમા ઉધના ક્રોસ કરવા માટે બનાવવામાં આવેલા પોલીસે ઘટના કઇ રીતે બની છે તે અંગે હોય છે. આ ઘટનામાં રાહદારીઓ સ્થાનિક લોકોના નિવેદન નોંધ્યા હતા. ઝેબ્રા ક્રોસિંગ પરથી કાયદેસર રીતે રોડ અકસ્માત બનતાની સાથે જ લોકોના ક્રોસ કરી રહ્યા હતા. તેમ છતાં પણ પર આવી ગયા હતા. જેને કારણે બસના ચાલકને રાહદારી દેખાયા નહી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને તેણે પુરપાટ ઝડપે બીઆરટીએસ

ધરપકડ કરી લીધી છે.

ચાર દિવસમાં બીજી ઘટના

સીટી બસ ચાલકો એટલી બેફામ થયા છે. જેમાં બેનાં મોત નીપજયાં છે. લોકોના ટોળા રસ્તા પર આવી ત્રણ દિવસ અગાઉ સરતના મોરાભાગળ ખાતે એક મહિલાને હાલ ઈજાગ્રસ્ત બે પૈકી અડફેટેલીધી હતી. જેમાં તેનું ઘટના

ઝેબ્રા ક્રોસિંગ પણ સલામત નથી ઝેબ્રા ક્રોસિંગ રાહદારીઓને રોડ ટોળા બીઆરટીએસ રૂટમાં તથા રસ્તા બેદરકારીભર્યું ડાઈવિંગ કરતા સીટી પોલીસે સીટીબસના ચાલક વિરુદ્ધ રૂટમાં બસ હંકારી હતી. શહેરમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ ટ્રાફિક નિયમોના ભંગને કારણે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બસનાં અકસ્માતો થાય છે.

#### ઈશાન ડાઈઝ એન્ડ કેમિકલ લીમીટેડ

CIN: L24110GJ1993PLC020737 રજીસ્ટર્ડ ઓફિસ: ૧૮, જીઓઈડીસી એસ્ટેટ, ફેઝ-૧, વટવા, અમદાવાદ-૩૮૨૪૪૫, ગુજરાત, ભારત ફોન નં: ૦૭૯-૨૫૮૩૨૧૪૪/૨૫૮૯૩૦૭ / ફેક્સ: ૦૭૯-૨૫૮૩૩૬૪૩ વેબસાઇટ: www.ishandyes.com / ઈ-મેઇલ: ishandyes@yahoo.com



રેગ્યલેશન ૨૦૧૫ સેબી (લીસ્ટીંગ ઓબ્લીગેશન એન્ડ ડીસકલોઝર રીકવાયરમેન્ટ) ના રેગ્યલેશન ૪૭ ... ડાયરેકટરર્સોની મીટીંગ સોમવાર, ૧૧મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ કંપનીની રજીસ્ટર્ડ ઓફીસે ૩૧મી, ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ પુરા થતા ત્રીમાસિક અને નવુ માસિકના અન-ઓડીટેડ ફાઇનાન્સીયલ

પરિણામોની મંજુરી માટે મળનાર છે. આ માહિતી કંપનીની વેબસાઇટ <u>www.ishandyes.com</u> પર પણ કંપનીની શેર લીસ્ટેડ છે ત્યાં સ્ટોક એક્ષચેન્જની વેબસાઇટ <u>www.bseindia.com</u> પર પણ ઉપલબ્ધ છે. ઇશાન ડાઇઝ એન્ડ કેમીકલ્સ લીમીટેડ વતી

તારીખ : ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૯ સ્થળ : અમદાવાદ

પિયષભાઈ નટવરલાલ પટેલ મેનેજીંગ ડિરેક્ટર ડીન-૦૦૪૫૦૮૦૭

Place : Ahmedahad

Date: 30 January 2019

### MAS FINANCIAL SERVICES LTD.

Read, Office: 6.Ground Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009 Phone No.: +91 79 41106500, Fax No.: +91 79 41106597, E-mail: riddhi\_bhayani@mas.co.in, Website: www.mas.co.in CIN: 1 65910G.11995PI C026064

			Standalone		Consolidated			
Sr. No.	Particulars	Quarter ending 31st Dec, 2018 (Unaudited)	Nine months ending 31st Dec, 2018 (Unaudited)	Quarter ending 31st Dec, 2017 (Unaudited)	Quarter ending 31st Dec, 2018 (Unaudited)	Nine months ending 31st Dec, 2018 (Unaudited)	Quarter ending 31st Dec, 2017 (Unaudited)	
1	Total income from Operations	16,183.52	41,813.57	11,771.00	17,051.23	44,137.82	12,465.3	
2	Net Profit/(Loss) for the period (beforeTax, Exceptional and/or Extraordinary items)	6,935.78	16,987.09	4,614.36	7,016.91	17,300.69	4,693.9	
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	6,935.78	16,987.09	4,614.36	7,016.91	17,300.69	4,693.9	
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	4,545.36	11,050.04	3,011.32	4,613.48	11,301.52	3,061.9	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive income (after tax)]	4,278.63	10,306.17	1,566.49	4,348.17	10,560.38	1,617.6	
6	Paid up Equity Share Capital	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.2	
7	Reserve (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet [refer note number c)]	*	-	-		w.		
8(i)	Earning Per Share(of ₹ 10/- each)(for continuing and discontinued operations) - ((including exceptional item)(not annualised for guarter)							
	1. Basic (₹)	8.32	20.22	5.56	8.44	20.60	5.5	
	2. Diluted (₹)	8.32	20.22	5.56	8.44	20.60	5.9	
8(ii)	Earning Per Share(of ₹ 10/- each)(for continuing and discontinued operations) - ((excluding exceptional item)(not annualised for guarter))							
	1. Basic (₹)	8.32	20.22	5.56	8.44		5.5	
	2. Diluted (₹)	8.32	20.22	5.56	8.44	20.60	5.:	

Committee in their Meeting held on 28th January, 2019 and the same was approved by the Board of Directors in their meeting held on 30th January, 2018, subjected to a limite review by the Statutory Auditors and filed with the Stock Exchanges under Regulation 33 and Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchanges at www.bseindia.com, www.nseindia.com, and on the website of the company at www.mas.co.in.

he unaudited standalone and consolidated financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") prescribed under section 133 of the Companies Act 2013 (the 'Act'). The Company has adopted ind AS from 1 April 2018 with effective transition date of 1 April 2017 and accordingly, these financial results together with the results for the comparative reporting period have been prepared in accordance with the recognition and measurement principles as laid down in Ind AS 34 - Interior inancial Reporting, prescribed under section 133 of the Act and the other accounting principles generally accepted in India.

This transition to Ind AS has been carried out from the erstwhile Accounting Standards notified under the Act, read with rule 7 of Companies (Accounts) Rules 2014 (as amended) guidelines issued by Reserve Bank of India ('RBI') and other generally accepted accounting principles in India (collectively referred to as the 'Previous GAAP'). Accordingly, the mpact of transition has been recorded in the opening reserves as at 1 April 2017 and the corresponding adjustments pertaining to comparative previous quarter as presented in these nancial results have been restated / reclassified in order to conform to current period presentation

hese unaudited standalone and consolidated financial results have been drawn up on the basis of Ind AS that are applicable to the Company effective from 1 April 2018 based on the Press Release issued by the Ministry of Corporate Affairs ('MCA') on 18 January 2016. Any application guidance / clarifications / directions issued by RBI or other regulators ar

Reserve (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year ended on March 31, 2018 as per previous GAAP was ₹ 65,925.95 Lakt (Standalone) and ₹ 66,520.53 Lakt (Consolidated) respectively.

Kamlesh C. Gandh (Chairman & Managing Director (DIN - 00044852)



## Congress women workers try to 'honour' Vaghani's wife

Ahmedabad/RAJKOT: Congress is is no mood to spare Gujarat BJP president Jitu Vaghani for his 'crass and insensitive' remarks on the Gandhi family scions.

Dozens of women workers of the Congress were detained when they went to Vaghani's house in Bhavnagar to honour his wife. Parul Trivedi, a Congress councillor, leading the agitation, said, "We wanted to felicitate Vaghani's wife for tolerating this kind of man for so many

Vaghani had courted controversy while addressing party workers on Sunday in Radahnpur town of Patan district. Vaghani had said the Gandhi scions were born amid security cover of commandos. "They can't even differentiate between a brinjal and a potato. Those born with commandos around their cradle out of fear that they would be kidnapped or something untoward would

say: "I am not sure if the commandos were around police station, from there when they were being fed they were released later in



it," drawing cheers from the party workers.

The women Congress workers held a protest in front of Vaghani's house at Iskon Mega City. However police didn't allow the women to enter the house and de-Vaghani then went on to tained nearly 20 of them. They were taken to A division

In Rajkot, women Congress workers burnt Vaghani's effigy outside collector office to register their protest. They also submitted tral property. BJP has a memorandum to the district collector demanding action bibing Indian values and we against Vaghani for his state-

plained that he did not mean their abilities and not beany disrespect to women. "I cause any family surname,"

of Gandhi family members born with a silver spoon and who are exploiting this country thinking its their ancesemerged as a party by imgive utmost respect to women. Women leaders in Vaghani on his part ex- our party have grown on

# **Sharad Pawar welcomes** Shankersinh Vaghela into NCP

Gujarat chief minister Shankersinh Vaghela joined the Nationalist Congress Party (NCP) as the its national general secretary on Tuesday in the presence of NCP supremo Sharad Pawar and senior party leader Praful Patel. While joining the party, the 78-year-old Vaghela, who is popularly known as "Bapu", said he will work to unseat the BJP-led government at the Centre by working to unite all anti-BJP parties. Vaghela, however, avoided commenting on whether he would contest the 2019 Lok Sabha polls. Vaghela formally filled his NCP membership will contest the election or form and handed it over to not Pawar in the presence of a media contingent.

very old relationship with his stature and experience Shankersinhji. He will be made the national general secretary of the party. His long experience will be used by the NCP to unite non-BJP parties not only in Gujarat but across the country."



cided whether he (Vaghela)

"We were in touch with Vaghelaji for some time and Pawar said, "We have a I am happy that a leader of has joined our party. I welcome him into the party," Pawar said.

Vaghela said, "I had meetings with Pawarji in Pune and Mumbai some time back and he asked me to join the NCP. On whether Vaghela Now, at a time when the BJP would contest the Lok Sabha government at the Centre is said. elections, Pawar said, "At this destroying all institutions in-

juncture, it has not been de- cluding the CBI, ECI, CVC, Supreme Court, RBI and CAG, I thought I must play my role democracy. This (NDA) gov- gress leader Ahmed Patel and ernment is a government of conspiracy and corruption only. I was CM, leader of opposition and Union minister Vikalpa Morcha ahead of the and have got so much from 2017 assembly elections, the people. Now it is my turn with his candidates contestto return something to the ing on the All India Hindustan public and that is why I want Congress Party symbol. After to do something in the na- all his candidates lost their tional interest. I want to save deposits in the 2017 election, the country from the BJP," he

"It's not about Modi hatao relevant.

(remove Modi) but about saving the country from misrule," Vaghela added.

The NCP will be the seventh party Vaghela has joined in his long career. An active RSS member, he got started in politics from the Jan Sangh and was jailed during the Emergency. He was elected to the Lok Sabha in 1977 on a Janata Party ticket. From 1980 to 1991 he held various party positions in the BJP in Gujarat. In 1995, he rebelled and formed his own party, the RJP and became CM with Congress support. He then merged his party with the Congress in 1998. He left the Congress in August 2017, afin checking this throttling of the voting against senior Conin favour of the BJP in the

Rajya Sabha elections. He then formed the Jan he was looking for a political platform like the NCP to stay

# NRI property case: Kingpin denied anticipatory bail again

VADODARA: The sessions court on Tuesday rejected the anticipatory bail application of Dharmveersinh Jadeja - kingpin of NRI property case.

Jadeja had filed for anticipatory bail even after his earlier plea was rejected and he had withdrawn his application from Gujarat high court. Jadeja had sought bail claiming that the investigating officer included section 409 of Indian Penal Code in the original FIR and after that the stamp vendor arrested in the case was allowed bail.

Opposing Jadeja's application, additional public prosecutor Ramesh Gianchandani argued that Jadeja's role in the entire case is suspicious completely different than the because the sale deed in photo of the property which which he is stated as the is in the sale deed,"



bona fide purchaser raises

"The property which is described in the sale deed is

Gianchandani said. He also pointed out that the co-accused Dilip Patel had admitted in his statement that not be permitted bail," the Jadeja was involved in the il-

legal transactions.

had also submitted an affidavit opposing Jadeja's bail application. The affidavit stated that Jadeia's custodial interrogation is necessary due to which he should not be allowed bail.

The court of additional sessions judge A A Nanvati upheld the arguments and rejected Jadeja's application. The court observed that there is a need for intense investigation and interrogation in the case.

"The applicant has sought anticipatory bail on the same grounds on which his previous plea was turned down therefore legally too he cancourt stated.On December 20 too, Jadeja was denied an-The investigating officer ticipatory bail.

### Seven arrested for assaulting woman, chopping off her hair

Gujarat for allegedly assaulting, abusing and chopping off the hair of a woman a few days ago, police said.

been in circulation on social

DAHOD (GUJARAT): media platforms for several Seven persons were on Sat- days now, following which the urday arrested in Dahod in police began a probe, an of-

ficial said Saturday. "The woman, married with two children, from Nani Kharaj village here was assaulted by a A video of the incident has group of people, including her relatives, for running away to R Patel said. A case was regis-

Ahmedabad reportedly with her tered under sections 323 (vollover," a Dahod rural police sta-

tion official said. "She was brought back to the village where she was beaten up and voke breach of the peace), 509 her hair chopped off. The entire incident was recorded on a mobile phone as well," Inspector B woman) of the Indian Penal

untarily causing hurt), 342 (wrongful confinement), 504 (intentional insult with intent to pro-(word, gesture or act intended to insult the modesty of a Code as well as section 67 (A).

### Morarji's words of wisdom saved Dandi from flooding AHMEDABAD/SURAT:

Tourism in Dandi, the coastal village in Navsari district that got etched on global map when Gandhiji broke the Britisher's draconian salt law in 1930, is all set to a further boost when Prime Minister Narendra Modi inaugurates the Dandi Salt Memorial on Wednesday.

But this little hamlet that was once a small island between the sea owes its existence to another Gujarati former PM Morarji Desai. Had it not been for vision of Desai, then chief minister of erstwhile Bombay state, the iconic Saifee Villa and the village itself would have walked into oblivion despite Gandhiji making history there.

Very few except the elderly people living here know that high tides used to inundate the entire village from the huge creek and the Saifee Villa. As Dandi started earning fame across India after the salt satyagrah, concern grew among villagers about the existence of Dandi as the threat of sea water flooding perennially loomed.

In the early 1950s, they sought help of Desai who advised them to form a cooperative and construct a kutcha dam between Dandi and Samapur village to stop sea water from entering. Desai told them that the choice was between the village and salt. The creek was nearly 25-feet wide and around 50-feet deep.

He wrote on the application by the villager that 'cooperative efforts must be tried to save the village having historical importance'.

Dandi had the natural source of salt due to the presence of creek. The salty water would flow into the village during the high tide and receding waters left natural formation of salt under the sunlight. However, villagers chose to sacrifice the salt and started cooperative efforts to build a kutcha dam.

Dhirubhai Patel, 89, secretary of Vinay Mandir School in Dandi told TOI: "As a child, I still remember how sea water gushed into our village and flooded our verandahs during the high tide from the

#### **AMARNATH SECURITIES LIMITED**

CIN NO. L67120GJ1994PLC023254 Regd. Office: 1/104, Sarthak, Opp. C.T. Centre.B/H. Swastik Cross Road. C.G.Road. Ahmedahad-380009 Corporate Office: B 207, CITI Point, Nr. Kohinoor Hotel, J B Nagar, Andheri, Mumbai - 59

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2018

	Quarter ended Nine Months ended Yea						
Sr.	Particulars		Quarter ended			Nine Months ended	
No.	r articulais	31.12.2018	30.09.2018	31.12.2017	31.12.2018	31.12.2017	31.03.2018
340.		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Revenue from operations	9,95,744	9,99,835	26,88,115	30,37,579	44,98,941	54,35,031
	Other income	3,535			3,535		
	Total revenue	9,99,279	9,99,835	26,88,115	30,41,114	44,98,941	54,35,031
2	Expenses						
0	Employee benefits expense	1,51,610	1,29,510	1,50,000	4,47,815	3,55,000	5,17,450
	Depreciation and amortization expense	16,246	16,246	23,949	48,738	71,847	95,796
	Other expenses	1,59,791	2,10,884	1,60,126	5,70,372	3,88,100	7,92,767
	Total expenses	3,27,647	3,56,640	3,34,075	10,66,925	8,14,947	14,06,013
3	Profit/(Loss) from ordinary activities						
-	before tax	6,71,632	6,43,195	23,54,041	19,74,189	36,83,994	40,29,018
4	Tax expense:						
-	(1) Current tax	1,74,209	1,66,886	5,39,241	5,12,145	9,56,471	11,11,089
	(2) Deferred tax	(1,264)	(1,264)	5,487	(4,434)	(787)	(3,401)
5	Profit/(Loss) from ordinary activities						
	after tax	4,98,687	4,77,573	18,09,313	14,66,478	27,28,310	29,21,330
6	Other Comprehensive Income (OCI)	-	-	-	-	-	-
	Total Other Comprehensive Income (OCI)	-	-	-	-	-	-
	Profit/(Loss) for the Period	4,98,687	4,77,573	18,09,313	14,66,478	27,28,310	29,21,330
	Paid up Equity Share Capital						
	(Face Value of Rs. 10 each)	3,00,02,000	3,00,02,000	3,00,02,000	3,00,02,000	3,00,02,000	3,00,02,000
6	Earning Per Share (EPS) (Not annualised)						
	(1) Basic	0.166	0.159	0.603	0.489	0.909	0.974
	(2) Diluted	0.166	0.159	0.603	0.489	0.909	0.974

1. The above Financial Results which are published in accordance with the regulation 33 of the Securities and Eychange Board Of India (Listing obligations & Disclosure Requirements) Regulations, 2015 have been reviewed and recommended by Audit

Committee and has been approved by the Board of Directors at its Meeting held on Wednesday, 30th January, 2019. The company has adopted Indian Accounting Standard (Ind AS) effective from 1st April' 2017 (Transition date being 1st April' 2016) and accordingly the financial results for the quarter 31st December, 2018 have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind As-34 Interim Financial Reporting prescribed under section 133 of the

Companies Act' 2013. The company has only one business segment

In compliance with the provisions of RBI Act, company has transferred 20% of the net profit, to the "Statutory Reserve a/c".

Previous quarter figures have been regrouped /reclassified whereever necessary, to make them comparable

For Amarnath Securities Limited Hitesh Ruke Whole-Time Director

(DIN-07752179

Place: Mumbai Dated: January 30, 2019

### **PUBLIC NOTICE aicici** Bank

Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007, Gujarat. Corporate Office: ICICI Bank Towers, Bandra Kurla Complex, Bandra (E), Mumbai- 400051

Branch Office: ICICI Bank Ltd., Office Number 201- B, 2ND Floor, Road No 1 Plot No – B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra – 400604

A notice is hereby given that the following borrower/s have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non Performing Assets (NPA) The notice dated were issued to them under Section 13 (2) of Securetisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses as provided to the bank by them, that in addition thereto for the purposes of information of the said borrowers enumerated below, the said borrowers are being informed by way of this public notice.

Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ (Loan Account Number) & Address	Property Address of Secured Asset / Asset to be Enforced	Date of Notice Sent/ Outstanding as on Date of Notice	NPA Date
	Preksha Silk Corporation / Mr. Jay Chordiya (Partner) / Mrs. Sushila Bohra (Partner) / Mrs. Hemlata Chordiya (Gurantor) / Mr. Dharamnarayan Chopra (Gurantor) - 138505001547 - (1) Block No 163, Shri Kuberji Empire, Upper Ground Floor, Shop No Ug 103, Saroli, Surat - 395 010 (2) Plot No 18-19, Flat No 304, Happy Home A, Dagina Nagar, Opp. Madhi Ni Khamni, Udhna, Surat - 394 210 (3) 208, Dhiraj Park Apartment, Desai Falia, Udhna, Surat - 394 210	D-707, Shyam Rachna, Behind Vip Plaza, Vip Road, Vesu, Surat - 395007	January 10, 2019/ Rs. 58,09,298/-	Septe- mber 29, 2018
	Balaji Electricals/ Ashvinbhai J. Patel (Proprietor)/ Mrs. Labhuben Patel/ Mr. Ashvinbhai J. Patel-025705002732- (1) 402, Chandraprabhu Complex NR Navdeep Flats Highway, Mehsana-384002 (2) H-132, Sardar Dham GIDC-2, Nagalpur-27, Near Taksheela School, Mehsana-3284002	3rd Floor Shop 402- 405 Chandraprabhu Complex, NR Navdeep Flats, Highway, Mehsana- 384002.	January 10, 2019/ Rs. 2325772/-	March 01,2018

The above borrower/s and/or their guarantors (where ever applicable) are advised to make the payments of outstanding within period of 60 days from the date of issuance of notice U/s. 13 (2), failing which further steps will be taken after expiry of 60 days from the date of issuance of notice U/s. 13 (2) dated mentioned above as per the provisions of Securetisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002

Date: 31-01-2019 Place: SURAT Authorized Office

#### MAS FINANCIAL SERVICES LTD.

Regd. Office: 6,Ground Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009. Phone No.: +91 79 41106500, Fax No.: +91 79 41106597, E-mail : riddhi\_bhayani@mas.co.in, Website: www.mas.co.in CIN: L65910GJ1995PLC026064

			Standalone		(₹ in Lakł Consolidated			
Sr. No.	Particulars	Quarter ending 31st Dec, 2018 (Unaudited)	Nine months ending 31st Dec, 2018 (Unaudited)	Quarter ending 31st Dec, 2017 (Unaudited)	Quarter ending 31st Dec, 2018 (Unaudited)	Nine months ending 31st Dec, 2018 (Unaudited)	Quarter ending 31st Dec, 2017 (Unaudited)	
1	Total income from Operations	16,183.52	41,813.57	11,771.00	17,051.23	44,137.82	12,465.3	
2	Net Profit/(Loss) for the period (beforeTax, Exceptional and/or Extraordinary items)	6,935.78	16,987.09	4,614.36	7,016.91	17,300.69	4,693.9	
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	6,935.78	16,987.09	4,614.36	7,016.91	17,300.69	4,693.9	
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	4,545.36	11,050.04	3,011.32	4,613.48	11,301.52	3,061.9	
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive income (after tax)]	4,278.63	10,306.17	1,566.49	4,348.17	10,560.38	1.617.6	
6	Paid up Equity Share Capital	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.20	5,466.2	
7	Reserve (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet [refer note number c)]		-	-	-		\$\tag{\phi}\$	
8(i)	Earning Per Share(of ₹ 10/- each)(for continuing and discontinued operations) - ((including exceptional item)(not annualised for quarter))							
	1. Basic (₹)	8.32	20.22	5.56	8.44	20.60	5.	
	2. Diluted (₹)	8.32	20.22	5.56	8.44	20.60	5.	
8(ii)	Earning Per Share(of ₹ 10/- each)(for continuing and discontinued operations) - ((excluding exceptional item)(not annualised for guarter))							
	1. Basic (₹)	8.32		5.56	8.44	1	5	
	2. Diluted (₹)	8.32	20.22	5.56	8.44	20.60	5	

eview by the Statutory Auditors and filed with the Stock Exchanges under Regulation 33 and Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation 2015. The full format of the quarterly financial results are available on the websites of the Stock Exchanges at www.bseindia.com, www.nseindia.com, and on the website of the

133 of the Companies Act 2013 (the 'Act'). The Company has adopted Ind AS from 1 April 2018 with effective transition date of 1 April 2017 and accordingly, these financial results together with the results for the comparative reporting period have been prepared in accordance with the recognition and measurement principles as laid down in Ind AS 34 - Interir Financial Reporting, prescribed under section 133 of the Act and the other accounting principles generally accepted in India.

This transition to Ind AS has been carried out from the erstwhile Accounting Standards notified under the Act, read with rule 7 of Companies (Accounts) Rules 2014 (as amended) uidelines issued by Reserve Bank of India ('RBI') and other generally accepted accounting principles in India (collectively referred to as the 'Previous GAAP'). Accordingly, the mpact of transition has been recorded in the opening reserves as at 1 April 2017 and the corresponding adjustments pertaining to comparative previous quarter as presented in these

(Standalone) and ₹ 66,520.53 Lakh (Consolidated) respectively

Place : Ahmedabad

Date: 30 January 2019

hese unaudited standalone and consolidated financial results have been drawn up on the basis of ind AS that are applicable to the Company effective from 1 April 2018 based of the Press Release issued by the Ministry of Corporate Affairs ("MCA") on 18 January 2016. Any application guidance / clarifications / directions issued by RBI or other regulators are ented as and when they are issued / applicable

Reserve (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year ended on March 31, 2018 as per previous GAAP was ₹ 65,925,95 Lak

For and on behalf of the Board of Directors of

MAS Financial Services Ltd

Kamlesh C. Gandl (Chairman & Managing Director (DIN - 00044852)